



DBX-16080001020200 Seat No. _____

B. Com. (Sem. II) (CBCS) (W.E.F. 2016) Examination

July – 2022

Economics

(Principles of Micro Economics - 2) (Old Course)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

- સૂચના : (1) આંતરિક વિકલ્પને આધારે બધા પ્રશ્નોના ઉત્તરો લખો.
 (2) જમણી બાજુના અંક ગુણ દર્શાવે છે.
 (3) જરૂર જણાય ત્યાં આલેખ દોરો.

1 પૂર્ણ હરિકાઈવાળા બજારમાં પેઢી અને ઉદ્યોગની ટૂંકાગાળાની સમતૂલા સમજાવો. 20

અથવા

- 1 (અ) ઈજારાવાળા બજારમાં પેઢીની સમતૂલા અને કિંમત નિધારણ સમજાવો. 10
 (બ) ઈજારાનાં લક્ષણો વર્ણવો. 10

2 કિંમત ભેદભાવ એટલે શું ? તે ક્યારે શક્ય અને નફાકારક બને છે ? 20

અથવા

2 ઈજારાયુક્ત હરિકાઈમાં ટૂંકાગાળામાં કિંમત નિધારણ અને પેઢીની સમતૂલા સમજાવો. 20

3 વેચાણ ખર્ચ એટલે શું ? વેચાણ ખર્ચની માંગ રેખા ઉપરની અસરો સમજાવો. 15

અથવા

3 અલ્પહસ્તક ઈજારાનો અર્થ આપી ખાંચાવાળી માંગરેખાનો સિદ્ધાંત સમજાવો. 15

4 ભાડાનો આધુનિક સિદ્ધાંત સમજાવો. 15

અથવા

4 નફાનો જોખમ અને અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો. 15

ENGLISH VERSION

Instructions :

- (1) Give the answer of all questions on basis of internal option.
- (2) The right side digits indicate marks.
- (3) Draw the diagram if necessary.

- 1 Explain the equilibrium of a firm and industry in short run in perfect competition type market. **20**

OR

- 1 (a) Explain the equilibrium and pricing of the firm under monopoly. **10**
(b) Explain the characteristics of monopoly. **10**

- 2 What is price discrimination ? When does it become possible and profitable ? **20**

OR

- 2 Explain the pricing and equilibrium of firm in short run under monopolistic competition. **20**

- 3 What is selling cost ? Explain the effects of selling cost on demand curve. **15**

OR

- 3 Give the meaning of oligopoly and explain the principle of kinked demand curve. **15**

- 4 Explain the modern theory of the rent. **15**

OR

- 4 Explain the Risk and uncertainty theory of profit. **15**
